

ત્વરિત જાહેરાત માટે

## સિટીનો 2022 નો નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ ફરી આવી રહ્યો છે.

બ્રમ્પટન, ઓન્ટારિયો (04 ઓગસ્ટ 2022) – સીટી ઓફ બ્રમ્પટનનો નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ ફરી મંગળવાર, 09 ઓગસ્ટ 2022ના રોજથી શરૂ થશે.

નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામનો હેતુ નાગરિક પ્રવૃત્તામાં સુધારો લાવવાનો છે, નિવાસીઓનું સશક્તિકરણ કરવું જેથી તેઓ પોતાના પાડોશના વિસ્તારને ઉન્નત કરવામાં સક્રિય ભૂમિકા ભજવે અને તેઓ સંસાધનો મેળવી શકે. રહેવાસીઓ પોતાના પાડોશના વિસ્તાર વિશે વધુ જાણકારી મેળવવાના અને પોતાને માટે જે મહત્વનું હોય તેની ઓનલાઈન આપલે કરવા માટે ત્રણ માર્ગો છે:

- નેબરહૂડ્સ વોક્સ – આખા બ્રમ્પટન ફરતે પાંચ વોક્સ અને વર્કશોપ્સનું આયોજન છે: ફ્લેયર્સ મેડો N/S અને વેન ક્લક, લંડી વિઈલેજ અને ફ્લેયર્સ કીક, બ્રેમલિ G-સેક્શન, કેસલમોર એસ્ટેટ્સ અને વાઈલડફિલ્ડ, અને શેરિડાન.
- વર્ચુઅલ ટૂર્સ – દસ વર્ચુઅલ ટૂર ઉપડશે, જે પાડોશની રત્નસમ જગ્યાઓ પર ભાર મુકશે.
- પાડોશ સર્વેક્ષણ – સિટી સમાજના વિવિધ પાડોશને સમજવા માંગે છે તેમજ તે કે ત્યાં રહેતા નિવાસીઓ એકબીજા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. રહેવાસીઓને ઓનલાઈન સર્વેક્ષણમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
- ઓનલાઈન મેપિંગ ટૂલ – આનાથી રહેવાસીઓ તેમની ગમતી જગ્યાઓ ઓળખી શકશે તેમજ આખા શહેરમાં તેઓ જે ફેરફારો જોવા માંગતા હોય કે સમસ્યાઓ હોય તેને ઓળખી શકશે.

બ્રમ્પટનવાસીઓ તરફથી ટૂંકા વિડિયોને આવકારવામાં આવશે જેમાં તેમના ગમતા પાડોશના સ્થળોને ઉજાગર કરવામાં આવ્યા હોય જે કરવાથી પુરસ્કારો જીતવાની તક સાંપડશે! ઓગસ્ટ 14 સુધીમાં સિટીને તમારા મનપસંદ સ્થાનિક સ્થળો જણાવશો. પસંદ કરેલ વિડિયો આ વર્ષના પ્રોગ્રામમાં દેખાશે! વિડિયો ઓનલાઈન અહીં રજૂ કરવા [www.brampton.ca/communitysafety](http://www.brampton.ca/communitysafety).

સિટીના ગુણવત્તાવાળા નિ:શુલ્ક પ્રોગ્રામિંગ પૂરા પાડવાના પ્રયાસ જે સમુદાયના દરેક માટે સુલભ હશે તેને પ્રાયોજકોનું સમર્થન છે. નર્ચરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામનું ઉદાર પ્રાયોજન ફરી એક વખત અલેક્ઝા અને એન્ડ્રિજ ગેસ કરી રહ્યા છે.

નર્ચરિંગ નેબરહૂડ્સ વિશે વધુ માહિતી અને વર્ચુઅલ નેબરહૂડ્સ વોક્સની આખી સૂચિ માટે અહીં મુલાકાત લો [www.brampton.ca/communitysafety](http://www.brampton.ca/communitysafety).

### 2021 કાર્યક્રમ

ગત વર્ષે, સિટીએ આખા બ્રમ્પટનમાં 15 નેબરહૂડ્સની ઓડિટ કરાવી હતી જેથી બ્રમ્પટનવાસીઓને પ્રવૃત્ત કરી શકાય અને

નાગરિકોના સમાજને ભેગું કરવામાં પ્રોત્સાહન મળી શકે. 2021માં નર્થરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ મારફતે પોતાના સમાજને આકાર આપવા માટે 1300 કરતા વધુ રહેવાસીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. સિટીને 900 કરતા વધુ સર્વેક્ષણના જવાબો પ્રાપ્ત થયા હતાં, અને ઓનલાઇન મેપિંગ ટૂલને 450 કરતા વધુ પિન્સ પ્રાપ્ત કરી હતી. 2021 પરિણામો પર વધુ માહિતી માટે, અહીં મુલાકાત લો [www.brampton.ca/ncommunitysafety](http://www.brampton.ca/ncommunitysafety).

## સુવાક્યો

પડોશની વાત આવે જેને તેઓ ઘર ગણે છે ત્યારે આપણા રહેવાસીઓ જ ખરા વિશેષજ્ઞો છે, અને તેઓને પોતાના સમાજ વિશે ગમે છે અને તેઓને કેવા પરિવર્તનો જોવા ગમશે તે અંગેના તેમના મત અમૂલ્ય છે. સ્વાસ્થ્યપ્રદ અને સુરક્ષિત શહેર તરીકે અમારી ઈચ્છા છે કે તમામ બ્રેમ્પટનવાસીઓ પોતાના પાડોશમાં સુરક્ષિત રહે અને તેમનામાં પોતાનાપણાની લાગણી હોય અને પોતાના સમુદાયમાં સક્રિયપણે સહભાગી થવાનો અવસર છે. નર્થરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામમાં ભૂતકાળમાં જેઓ ભાગ લઈ ચુક્યા છે તેમનો આભાર માનીએ છીએ અને ફરી અમારા રહેવાસીઓ સાથે પ્રવૃત્ત થવા અમે ઉત્સુક છીએ જેથી વધુ જાણકારી મળી શકે.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રેમ્પટન

"સિટી ઓફ બ્રેમ્પટન એવું શહેર ઊભું કરવા પ્રતિબદ્ધ છે જેને પોતાનું ઘર તરીકે માનવામાં અમારા તમામ રહેવાસીઓને ગર્વ થાય. નર્થરિંગ નેબરહૂડ્સના સ્થળોનો રૂબરૂ પ્રવાસ ખેડવા, ઓનલાઇન પોતાના અભિપ્રાયો આપવા અથવા અમારા એકાદ નક્કી કરેલા વોક્સમાં આવવા અને પુસ્કાર જીતવા માટે પોતાના મનગમતા પાડોશના સ્થળોનો વિડિઓ બનાવવા તમામ બ્રેમ્પટનવાસીઓને આમંત્રણ છે. તમારો અભિપ્રાય મૂલ્યવાન છે, અને તમે અમને ટકાઉ અને અક્ષત સમુદાયો બનાવવામાં મદદ કરવામાં અનિવાર્ય ભૂમિકા ભજવો છો.

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"નર્થરિંગ નેબરહૂડ્સ પ્રોગ્રામ બ્રેમ્પટનવાસીઓને એવી તક આપે છે જેથી રહેવાસીઓ પોતાના સમુદાય વિશે જે ગમતું હોય તે શેર કરી શકે અને સિટીની આવનાર પરિયોજનાઓ અંગે માહિતી મેળવીને સ્થાનિક સ્તરે પરિવર્તનને પ્રેરિત કરી શકે. ગત વર્ષોમાં જેમણે પ્રોગ્રામમાં ભાગ લીધો હતો તેમનો બધાનો આભાર અને અમે આ વર્ષના પ્રોગ્રામના માધ્યમથી અમારા રહેવાસીઓ સાથે પ્રવૃત્ત થવા ઉત્સુક છીએ."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ, અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

मिडिया संपर्क (MEDIA CONTACT):

सीटी ओड् ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)